



તમારા કુંદુંબની સલામતીની ખાત્રી માટે તમારે ધ્યાં બધું જાણવાની જરૂર છે. તે માટે મહેરબાની કરીને તમારા સ્થાનિક ક્ષાયર સ્ટેશન, ક્ષાયર પ્રીવેન્શન/પબ્લિક

ટોરન્ટોની અભિનશમન સેવા સંસ્થા આપની અને આપના કુંદુંબની સલામતી માટે આપના સાથ સહકાર માટે આમંત્રે છે.

આગ રોકવા માટે

આપના ઘરમાં આગનું જોખમ હોય તેવી વસ્તુઓ તપાસી આગ ન લાગે તે માટે તેનું નિવારણ કરો. ઘરમાં આગ લાગવાના ધ્યાનબારા બનાવોમાં રસોઈ કરતી વખતે નિજીબન્દિ, ધૂમ્રપાન અને મીથાબતીનો ઉપયોગ કરણભૂત હોય છે.

આગની જાણ થાય તે માટે

સ્પોક અલાર્મ ચાલુ હાલતમાં હોય તે અત્યેત જરૂરી છે; કાયદા પ્રમાણે તમારા ઘરના દરેક માળ ઊર અને શયનસ્થાનો બહાર તે હોવાની જોઇએ.

બહાર નીકળી જરૂર

સંકટ સમયે બચાવ માટે દરેક ઓરડાથી બહાર નીકળવાના બે માર્ગોનું આયોજન કરી રિયાઝ કરો અને તમારા ઘરના આગામના ભાગમાં બેગાં થવાની જગ્યા નક્કી કરો.

અભિન સુરક્ષા માહિતી



આગમાંથી સહિસલામત નીકળવા પૂર્વ ચેતવણી માટે ચાલુ હાલતમાં હોય એવા સ્પોક અલાર્મની તમારે જરૂર પડશે. તમારા ઘરમાં યોગ્ય સ્થળે સ્પોક અલાર્મ ગોઠવી વર્ષમાં ઓછીમાં ઓછી એક વાર બેટરીઝ બદલાય તેની ખાત્રી રાખો.




બધાં શયનસ્થળો નજીક કાર્બન મોનોક્સાઇડ અલાર્મ ગોઠવો.



રસોઈ થતી હોય ત્યારે રસોડામાંજ રહો; સ્ટવની આજુબાજુની જગ્યા સાક રાખો અને તપેલી/પાનનું ટંકણું હાથવગું રાખો જેથી આગ શરૂ થતાંની સાથેજ તેની પર "ટંકણું મૂકી દેવાય.



જેવી આગ લાગે કે બહાર નીકળી જાઓ અને 911 ને તરતજ ક્રીન કરો.



ઇમરજન્સી વાહનની લાઇટ્સ જોતાં તમાડું વાહન જમાડી બાજુએ રાખો અને સાઈરન સંભળતાની સાથેજ થોભો □-□ પ્રત્યેક ક્ષાળ મહત્વની છે.



ઓરડાની બહાર નીકળતા પહેલાં અથવા સુવા જતી વખતે બધી મીથાબતીઓ બુઝાવી દો. મીથાબતી ભરવવાના મજબૂત સાધનો રાખો અને બાળકે તથા પાણેલા પ્રાણીઓથી મીથાબતીઓ ફૂર રાખો.



દીવાસળીઓ અને લાઇટર્સ ઉચે તેમજ બાળકેની નજર અને પહોંચની બહાર રાખો.



સિગારેટના ઠૂઠા બરાબર ઓલવાય તેની ખાત્રી કરો અને ઓલવાયેલા ઠૂઠાજ ટ્રેશમાં ખાલવો.



જેમાં સર્કિટ-બ્રેકર્સ હોય એવાજ પાવરબાર્સ વાપરો; નુકસાનની કોઈસનો ઉપયોગ કદાચિન કરો અને બજે તેવી વસ્તુઓથી હીટર્સ ફૂર રાખો.



બધારે પ્રમાણમાં દાડનું સેવન ભયાનક આગમાં કરણભૂત છે □-□ તમારા ઘરમાં જે કોઈ બધારે દાડ પીધા પણી ધૂમ્રપાન કરતા હોય કે રસોઈ કરતા હોય તેનું ધ્યાન રાખો.